

# BUSINESS મિત્ર Plus

## ઈરાન પર અમેરિકીએ હવાઈ હુમલાથી અખાતી તનાવ ચરમસિમાએ, કુડમાં તેજીનું કમબેક

ઈરાનમાં ફોરડો, નાટાન્ઝ અને ઈસ્ફાહાન ન્યુક સાર્ટસ પર અમેરિકાએ આક્રમક હુમલા કરતા ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુધ્ધમાં સ્ટ્રેટેજિક કેલક્યુલસ બદલાઈ ચૂક્યું છે. હવે આગળ જતા યુધ્ધ લાંબા ગાળાની શાંતિમાં પહોંચી શકે છે. ઈરાનના વોર ઓફ એડિશન બને છે એ કહેવું લગભગ અસંભવ છે. રાજનીતિ હોય કે અર્થનીતિ, અમેરિકા પ્રેસિડન્ટને એટલાં શોક ટ્રીટમેન્ટની રણનીતિમાં ફાવટ આવી ગઈ છે. જ્યારથી ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી એક પણ વીકન્ડ મોટી ઈવેન્ટ વીના ખાલી જાતો નથી. દરેક વીકએન્ડમાં કોઈક મોટી ઘટના બને છે જે બજારોમાં મોટા સ્વિંગ લાવે. આવી ઈવેન્ટ યા તો ટેરિફ સ્વરુપે ત્રાટકે છે યા તો વોર અથવા સ્ફોટક નિવેદનો રૂપે ત્રાટકે છે. આ ટ્રેન્ડને જોવાનુજોગ જ કહીએ, મેથોડિકલ મેનિપ્યુલેશન કહીએ તો વળી પાછા કોન્સિપરસી થીઅરીનું આજ લાગી જાય!!

સોનાચાંદી એ ઓઈલ જેવી વોર કોમોડીટીમાં ટ્રેડર્સ વીકએન્ડમાં ઓપન પોઝિશન ઉભી રાખે તો સોમવારે મોટા માર્જિન કોલ આવે એવો સેટઅપ હવે અપવાદ નહીં પણ નિયમ બની ગયો હોય એવું લાગે છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચે શુ થયેલી વોર હવે લેબેનોન, સિરિયા, યેમેન, ઈરાનમાં ફેલાઈ ચૂકી છે. અમેરિકાની સંડોવણી થતા હવે કૂટનીતિની ભાષામાં પાર્ટિ ઓઈ ઇન્ટરેસ્ટેરનીકે આઠ દેશો વોરથી સીધા પ્રભાવીત છે. યુરોપમાં રશિયા-યુક્રેન

વચ્ચે વોર ચાલુ છે. આફ્રિકામાં ગ્રેટ લેક રિજીયન તરીકે ઓળખાતો પ્રદેશ પણ હોટસ્પોટ છે. લિબિયમ, કોબાલ્ટ, હીરા જેવા કિમતી સંસાધનોથી તરબતર એવો આ પ્રદેશ રવાન્ડા, કોંગો, બુરુન્ડી, યુગાન્ડા, તાન્ઝાનિયા જેવા દેશોમાં પણ છમકલા શરૂ થયા છે. એ સીવાય મેડિટેરિયનમાં સર્બિયા-કોસોવો, એજ્યન સીમાં ગ્રીસ-તુર્કી-સાયપ્રસ, સેન્ટ્રલ એશિયામાં આરમેનિયા અને અઝર્બેજાન વચ્ચે પણ તનાવ જેવી સ્થિતિ છે. ચીન-તાઈવાન અને ભારત-પાકિસ્તાન બાંગલાદેશ વિસ્તારોમાં પણ ભારેલો અગ્નિ છે. આ સ્થિતિ વિશ્વયુદ્ધ જેવી નથી એમ કહીએ તો એ શાહમુગી ચિંતન તરીકે જાતને છેતરવા જેવું ગણાય. આગળ જતા યુધ્ધ વકરે તો કુડઓઈલ, ગેસ સોનું, સ્વિસ ફ્રાન્ક, યુરો, ડોલર વગેરેમાં તોફાની ચાલ આવે.

કુડની વાત કરીએ તો ઈરાન-ઈઝરાયેલ વોર પછી ૧૦ દિવસમાં જ ઓઈલ પરિવહન કરતા ટેન્કરના ભાડા ૪૦ ટકા વધી ગયા છે. ઓમાનના અખાતમાંથી ઓપન ઓસનમાં આવતા કુડ અન ગેસ- માલસામાનના પરિવહન માટે હોરમુઝની સામુદ્રી અત્યંત મહત્વનો જળમાર્ગ છે. વિશ્વનું ૨૦ ટકા તેલ આ માર્ગે પરિવહન થાય છે. જો ઈરાન હોરમુઝ જળમાર્ગમાં નાકાબંધી કરે તો તેલના ભાવ ૧૦૦ ડોલર વટાવી જાય એવી પ્રબળ શક્યતા છે. હવે યુધ્ધ શાંત પડે તો પણ કુડ નજીકના ભવિષ્યમાં ૬૦



ડોલર નીચે જાય એમ દેખાતું નથી. ૪૦-૫૦ ડોલર ફેર વેલ્યુ અને ૨૦-૪૦ ડોલર રિસ્ક પ્રિમિયમ ગણીએ તો કુડમાં નવો પ્રાઈસ ફ્લોર ૬૦-૮૦ ડોલર ગણાય. યુધ્ધ ફૂલ સ્કેલ વોરમાં પરિણે, ઈજિપ્ત, લિબિયા, આરબ દેશો

### બિરેન વકીલ

વગેરે પણ સીધી કે આડકતરી રીતે સંડોવાય તો કુડ ૧૦૦ ડોલર વટાવી જાય એ શક્યતા નકારાય નહીં. આ મામલે હવે તુસ્કાબાજીને બદલે રીઅલ ઇમ બેસીસ પર વેલ્યુએશન કરતા રહેવું પડે.

ઈરાન-અમેરિકા વોરને પગલે કુડમાં મોટી તેજી થાય તો રૂપિયો, યેન, ભારતીય શેરબજારો કામચલાઉ દબાણમાં આવે, સોનું, સ્વિસ ફ્રાન્ક, યુરો, બીટકોઈનમાં નવેસરથી તેજી થાય. ઇમજિંગ બજારોમાં કોમોડીટી કરન્સી જેવી કે બ્રાઝિલ રિયાલ, ઈન્ડો

દરમિયાન વ્યાજદરોમાં બેન્કો વચ્ચે તાલમેલ તૂટી ગયા છે. યુરોપ આક્રમક રેટકટ મોડમાં છે. સ્વિસ બેન્કે તો રેટકટ ઝિરો કરી નાખ્યા છે. આગળ પર રેટ નગેટિવ થઈ શકે એમ કહ્યું છે. હુનિયાભરમાંથી નાણાં સ્વિસ બેન્કોમાં ઠલવાય છે એટલે સ્વિસ ફ્રાન્કની તેજી રોકવા ઝિરો રેટ કર્યા છે. ૨૦૧૮માં સ્વિસ રેટ માર્ઇનસ પોણો ટકા હતા. ઈસીબીએ આઠ વાર રેટ ઘટાડી બે ટકા કર્યા છે. નોર્વેએ પણ અચાનક રેટ ઘટાડ્યો છે. યુકેમાં રેટ ૪.૨૫ ટકા છે. એશિયામાં ચીનના રેટ ૫ ટકા, ભારતમાં ૫.૫ ટકા છે. એક માત્ર અમેરિકા ફેરે રેટકટ લાંબા સમયથી હોલ રાખ્યા છે. ફેડ રેટ કટ નહીં ઘટાડે એવું સમજી ચૂકેલા ટ્રમ્પે

**બેન્કોની રેટવોર- સ્વિસ બેન્કે રેટ શૂન્ય કર્યા- ફેડે રેટ ચથાવત રાખ્યા, કુડની તેજીથી રૂપિયો, યેન, ભારતીય શેરબજારો કામચલાઉ દબાણમાં આવશે**

રૂપિયો અને જાપાની યેન દબાણમાં આવે. ડોલરને સેફ હેવન એસેટનો કામચલાઉ લાભ મળે પણ આગળ જતા કુગાવો વધવાના જોખમો, ફેડ વ્યાજદર ન ઘટાડે એવી શક્યતા અને યુધ્ધને કારણે અમેરિકા બજેટ પર આવેલા દબાણથી ઓલરેડી નબળી અમેરિકા ફિસકલ કંડિશન ઘણી નબળી પડીને ડીડોલરાઈઝેશનને બુસ્ટ આપે. હાલમાં પ્લાહી પરિસ્થિતીમાં હોટમની અને ડિપમની કયા આશરો શોધે છે એ જ જોવાનું રહે.

ફેડ ચેરમેન પોવેલ પર મિ લેટ, સ્ટુપીડ કહીને ફરીવાર અકળામણ ઠાલવી છે. પણ પોવેલ ગાજ્યા જાય એમ નથી. ટેરિફની અચોક્કસતા, કુડની તેજી જોતા પોવેલ જૂલાઈમાં પણ રેટકટ પાછો ઠેલો એ શક્ય છે. રિઝર્વ બેન્ક રેટકટ મોડમાં છે પણ કુડની તેજી જોતા રેટકટ પાછો ઠેલાઈ શકે. હાલના સંજોગોમાં બજારોની દશા અને દીશા અચોક્કસ છે એટલે આગાહીઓથી દૂર રહીએ. ડોલર-સ્વિસ ફ્રાન્ક-સોનું-યેન-કુડ-યુરો પર બારીક નજર રાખીએ.

## ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુધ્ધમાં અમેરિકા ફૂદી પડતા શેરબજારમાં અસ્થિરતા વધશે

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ જીદમાં ફેરવાઈ ગયું છે અને હવે આ લડાઈમાં અમેરિકાએ એન્ટ્રી કરી દીધી છે, જેથી યુદ્ધ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધું છે. અમેરિકા બાદ હવે રશિયા, ચાઈના મહાસત્તાઓ વચ્ચેના જંગમાં પ્રવેશી રહ્યાના સ્પષ્ટ સંકેતોને જોતાં વિશ્વના માથે ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઝળુંબી રહ્યું છે. અમેરિકાએ બે સપ્તાહના સમય આપ્યાની જાહેરાત કરી હતી, પણ તેના ચોવીસ કલાકમાં જ ઈરાનના ત્રણ પરમાણુ સ્થાનો પર બોમ્બ ઝીંકીને સીધી જ એન્ટ્રી કરી દીધી છે, જે અનઅપેક્ષિત એન્ટ્રીથી વિશ્વના અન્ય દેશો પણ અંચળામાં મુકાઈ ગયા છે અને ઈરાન દ્વારા વળતો પ્રકાર શરૂ થઈ ગયો છે અને આ યુદ્ધમાં અન્ય દેશો રશિયા અને ચીન પ્રવેશી શકે છે. જો આ બંને દેશો પ્રવેશશે તો યુદ્ધ વધુ ગંભીર થશે, નહીતર ઈરાન- ઈઝરાયેલ યુદ્ધના અંતને વાર લાગશે નહીં.

આ સ્થિતિમાં ગત સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં જે યુ ટર્ન આવ્યો હતો અને નિફ્ટીએ 25100ની

સપાટી કુદાવીને નવી તેજીના વરતારા જોવા મળ્યા હતા, તેને બ્રેક વાગી જશે અને આગામી સપ્તાહમાં ગેપડાઉન ઓપનીંગ થઈ શકે છે. આમ, ફરી એકવાર ભારતીય શેરબજારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે.

જ્યો પોલીટીકલ ટેન્શન ચાલી રહ્યું છે ત્યારે શેરબજારમાં મોટી ખરીદીથી દૂર રહેવું હિતાવહ છે, પણ એનર્જી તથા

ફુડ ઓઇલની સપ્લાય ઉપર અસર પડશે, જેનાથી કુડના ભાવ ઉછળતા ઓઇલ માર્કેટીંગ કંપનીઓને અસર કરશે


ડિફેન્સ શેરોમાં મોટા કડાકા ભડાકા થાય તો ખરીદીની તક ઝડપી લેવી જોઈએ, કેમ કે ત્યારે આ સેક્ટરમાં ઝડપી રીકવરી સાથે ઉછળવાની સંભાવના જોવા મળી રહી છે. છેલ્લા સપ્તાહમાં ત્રણ દિવસ બજારમાં

ઘટાડા વચ્ચે પણ વિદેશી રોકાણકારોની ખરીદી રહી હતી અને છેલ્લા દિવસે મોટા પાયે ખરીદી કરી હતી, આમ, વિદેશી રોકાણકારોની લેવાલીનો ટ્રેન્ડ જોતાં ભારતીય શેરબજારમાં મોટી ખાનાખરાબીની સંભાવના દેખાતી નથી અને સારા શેરોમાં રોકાણ કરવાથી લાભ જ થવાની સંભાવના છે. વૈશ્વિક યુદ્ધનો માહોલ હળવો થયા બાદ બજાર ફરી વિક્રમી તેજીની રાહે આગળ વધવાની પુરી શક્યતા છે.



### માર્કેટ વોચ

આવૃત્તીકાલે સોમવારના રોજ નવા સપ્તાહની શરૂઆત બજાર માટે અશાંત રહી શકે છે. ઈઝરાયેલ અન ઈરાન તણાવ વચ્ચે કેટલાક સેક્ટર ચર્ચામાં રહેશે, જેમાં ડિફેન્સ, બેન્કીંગ, રિયુએબલ એનર્જી, ફાર્મા અને ઓઈટી જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. જોકે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ફરી એકવાર કુડ ઓઈલનો સપ્લાય ધોંધમાં પડી શકે છે.



અને તેના લીધે કુડ ઓઈલના ભાવોમાં ઝડપી ઉછળણે આવવાની સંભાવના છે. આ ઉછળણથી ભારતને અસર કરશે, કેમ કે ભારત કુડ ઓઈલની 85 ટકા આયાત કરે છે. કુડ ઓઈલના ભાવ ઉછળતા ઓઈલ માર્કેટીંગ કંપનીઓના માર્જિનને સીધી અસર કરતી હોવાથી શેરોની કિંમતોને અસર કરશે. તેની સાથે ડિફેન્સ શેરોમાં પણ હલચલ જોવા મળી શકે છે, જેમાં પોઝિટિવ હલચલની સંભાવના દેખાઈ રહી છે.

રિયુએબલ સેક્ટરની દિગ્ગજ કંપનની હાલની સોલાર ઈપીસી ડીલને વધારીને રૂ. 246.92 કરોડની કરી દેવામાં આવી

છે. જે પ્રોજેક્ટની કુલ વેલ્યુ રૂ. 1480.40 કરોડ થઈ ગઈ છે. આ ઓર્ડર 2012.47 મેગાવોટના પીક ગ્રાઉન્ડ માર્પેડ સોલાર પ્રોજેક્ટ માટે છે.

આગામી સપ્તાહમાં ઓઈટી શેરોમાં મોટી વધઘટ જોવા મળી શકે છે કેમ કે વૈશ્વિક ઓઈટી દિગ્ગજ કંપની એક્સેન્ચરના પરિણામો છે, જેને સમગ્ર વર્ષમાં આવકમાં 6થી 7 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખી છે, જોકે, નવા બુકીંગમાં 6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે જનરેટિવ સમાર્થ બુકીંગ 1.5 અબજ ડોલર રહ્યું હતું. પરિણામ બાદ અમેરિકા બજારમાં એક્સેન્ચરનો શેર 7 ટકા ટૂટ્યો હતો.

## બજારના હાલના સંજોગોમાં ઘટાડે ખરીદીને ઉછાળે વેચવાનો અભિગમ જ યોગ્ય રહેશે

અત્યારે બજારમાં આનંદનો માહોલ છે કારણ કે નિફ્ટી અને સેન્સેક્સે તાજેતરની ઉચાઘટનો ફરીથી હાંસલ કરી છે અને ઘણા બધા ઘન્ટીસીસ કંઈક સિક્વરી બતાવી રહ્યા છે. વાસ્તવમાં સ્મોલ અને મિડ કેપ ઘન્ટીસીસ કંઈક નવેસરનો ઉત્સાહ બતાવી રહ્યા છે. ફક્ત બેન્ક નિફ્ટી અને આઈટી ઘન્ટીસીસ હજી કેચઅપ રમી રહ્યા છે. નિફ્ટીને આગળ વધવામાં સમય લાગ્યો તેનું એક કારણ એ પણ છે કે આ ઘન્ટીસીસમાં વજનદાર નામો બેન્કોંગ, આઈટી અને એફએમસીજીના છે અને તેમાંના મોટા ભાગના હાલ ધીમા રહ્યા છે.

પહેલા તો અમેરિકાના અર્થતંત્રના મજબૂત આંકડાઓ

આવ્યા અને પછી સ્થાનિક સ્તરે જીડીપીના અણધાર્યા ઉચા આંકડાઓ આવ્યા. આ બંનેએ બજારમાં ખરીદીને વેગ આપ્યો અને બજારમાં ફક્ત શોર્ટ કવરીંગનો સ્મોલ અને મિડ કેપ ઘન્ટીસીસ કંઈક નવેસરનો ઉત્સાહ બતાવી રહ્યા છે. ફક્ત બેન્ક નિફ્ટી અને આઈટી ઘન્ટીસીસ હજી કેચઅપ રમી રહ્યા છે. નિફ્ટીને આગળ વધવામાં સમય લાગ્યો તેનું એક કારણ એ પણ છે કે આ ઘન્ટીસીસમાં વજનદાર નામો બેન્કોંગ, આઈટી અને એફએમસીજીના છે અને તેમાંના મોટા ભાગના હાલ ધીમા રહ્યા છે.

**ચાર્ટ એક્સાઈઝ**

■ રાજા વેંકટરામન

જો કે જૂન સિરિઝનો મોટો ભાગ ટેન્જમાં વીલ્યો છે અને હવે તે ઉંચે જવા માટે સર્જ્ય જણાય છે. જૂન 2025માં એફઆઈઆઈએસએ પોતાની પોઝિશનો મેનેજ કરવા માટે નોન-લાઇનર અભિગમ અપનાવ્યો.

જો કે જુઓપોલીટિકલ સમાચારો ફૂલડાઉન સ્થિતિ સર્જવાનો સંકેત આપે છે. જ્યારે સોમવારે તે કેટલુક

શોર્ટ કવરીંગ એક્શન શરૂ થાય તો એક ગેપ સ્ટાર્ટ સંભવિતપણે જોવા મળી શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે ઘન્ટીસીસ 15ના મહત્વના શ્રેણીઓની નીચે ટ્રેડ કરી રહ્યો છે ત્યારે વોલેટાલિટી નોંધપાત્ર રીતે નાબૂદ થઈ ગઈ છે.

હવે પ્રશ્ન એ છે કે અહીંથી ક્યાં જવું? ચાર્ટ-1 સૂચવે છે કે આગામી સપ્તાહમાં ટેન્જ બ્રેક આઉટનો ઉપયોગ કરીને કંઈક અપસાઇડ ગતિ સર્જઈ શકે છે. આગામી સપ્તાહ માટે પણ આપણે ઘટાડે ખરીદીનો અભિગમ રાખી શકીએ. ટૂંકા ગાળાના ખેલાડીઓએ 24800ની નીચે મક્કમ સ્ટોપ રાખવો. ઉપલી બાજુએ 25200 વટાવતા નવી ઉચાઈ સ્થપાવામાં મદદ મળી શકે છે.




**નીઓટ્રેડર**

**NeoTrader**

**ફાયનાન્સની દુનિયામાં રહો આગળ!**

જો તમે શેરબજારમાં રિયલ ટાઈમ આંતરસૂચ સાથે ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો જોડાઓ નિઓટ્રેડર દ્વારા સંચાલિત ટેલિગ્રામ એડવાઈઝરી, CFO ગેઇન્સમાં. તો આ એડવાઈઝરીનો વિશેષ એક્સેસ મેળવવા ફક્ત નીચેની લિંક પર જાઓ અથવા અહીં આપણો QR કોડ સ્કેન કરી તમારી વિગતો ભરો...

<https://bit.ly/3Z9gg5v>



**DMAT: Cmp 4290.10**

**શેરબજાર અંગેના પ્રશ્નો લખી મોકલો ગુજરાતમિત્ર ભવન, સોની ફળિયા, સુરત-3ના સરનામા પર અથવા ઇમેઇલ કરો અમને chartadvise@gujaratmitra.in પર**

2025ના વર્ષમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જાણે કે વિશ્વભરમાં સોનાની ખરીદીની હોડ જામી હોય. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ, અમેરિકાનું ટેરિફ વોર, ઈઝરાયેલ-ગાઝા-ઈરાન યુદ્ધ સહિતના જીયો પોલીટીકલ ટેન્શન વધતું જોવા મળી રહ્યું છે, જે વિશ્વને સેફ હેવન ગણાતા સોના તરફ લઈ જઈ રહ્યા છે. આ ઉપરાંત, ટેરિફ વોરની સામે ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ કેટલાક દેશો પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલ છે અને તેના લીધે પણ ડોલરના બદલે સોના તરફ વળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



જેમાંથી 43 ટકા કેન્દ્રીય બેન્કોએ અનિશ્ચિત માહોલના કારણે સોનાની ખરીદી વધારી છે, જેઓ સોનાને સલામત વિકલ્પ માને છે. જે સોનાનો ભંડાર વધારવાની યોજના બનાવી રહી છે. જોકે, કોઈપણ બેન્ક સેક્ટરમાં ઘટાડાવાનું વિચારી રહી નથી. જ્યારે 95 ટકા કેન્દ્રીય બેન્કો માને છે કે, આ સમયગાળા દરમિયાન વૈશ્વિક કેન્દ્રીય બેન્કોના સોનાના ભંડારમાં સોનાની ખરીદીમાં વૃદ્ધિ પાછળના બે મુખ્ય કારણ ગણી શકાય. જેમાં પ્રથમ

વૈશ્વિક મેક્રો ઇકોનોમિક સમીકરણોમાં ફેરફાર અને બીજું ઉભરતા અર્થતંત્રો દ્વારા



### કોમોડિટી વોચ

પરંપરાગત પશ્ચિમી ચલણો પરની તેમની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

સેફ હેવન ગણાતા સોનાની ખરીદી ત્યારે જ થતી હોય છે, જ્યારે બજારમાં ઉથલપાથલ હોય. આ તેની વધતી માંગનું મુખ્ય કારણ છે. વધુ એક મહત્વનું

કારણ એ છે કે, આગામી વર્ષોમાં વૈશ્વિક અનામતમાં યુએસ ડોલરનો હિસ્સો ઘટી શકે છે. સર્વેક્ષણમાં લગભગ 73 ટકા કેન્દ્રીય બેન્કોએ આગામી પાંચ વર્ષમાં ડોલર હોલ્ડિંગ્સમાં મધ્યમથી મોટા ઘટાડાની આગાહી કરી રહી છે. બદલામાં યુરો તથા ચીની કરન્સી રેનમિનબી અને સોનામાં રોકાણ વધી શકે છે. જોકે, વર્તમાન સ્થિતિમાં જોઈએ તો યુએસ ડોલરનું વેપારમાં લેણદેણમાં પ્રભુત્વ યથાવત છે અને નજીકના ભવિષ્યમાં તેમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નહીંવત છે, પણ વિશ્વના કેટલાક દેશો યુએસ ડોલરનો વિકલ્પ શોધી રહ્યા હોય

**ભારતીય રિઝર્વ બેન્ક સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ સતત ત્રીજા વર્ષે 1000 ટનથી વધુ સોનાની ખરીદી કરી, મોટા ભાગની કેન્દ્રીય બેન્કોની આગામી પાંચ વર્ષમાં ડોલર હોલ્ડિંગ્સમાં મધ્યમથી મોટા ઘટાડાની આગાહી**

તેવું લાગી રહ્યું છે અને તે પૈકી એક વિકલ્પ સોનું થઈ શકે છે.

સેન્ટ્રલ બેન્કો દ્વારા આ જંગી ખરીદીની સાથે અન્ય ઘણા કારણોસર સોનાના

ચાંદીના ભાવમાં આકર્ષક તેજી જોવા મળી હતી. જેની પાછળનું કારણ પણ વિવિધ સેન્ટ્રલ બેન્કો અને સંસ્થાકીય રોકાણકારો દ્વારા સોનાની ખરીદીમાં વધારો હતું.

